

વેપાર ચિહ્ન સૂચના

અમારા અસીલ , ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ અને કેમિકલ્સ લિ. , (હવે પછી તેને " જીએસએફસી / અમારા ક્લાયંટ " તરીકે સંબોધવવામાં આવેલ છે), કે જે ભારત ના કાયદા હેઠળ આવતું એક બોડી કોર્પોરેટ છે અને તેના વ્યવસાય ની જગ્યા પોસ્ટ ફર્ટિલાઈઝરનગર-૩૮૧૭૫૦ જિ. વડોદરા, ગુજરાત, ઈન્ડિયા છે કે જેઓ ભારત માં નોંધાયેલા "સરદાર" ટ્રેડ માર્ક નાં માલિક છે જેનું રજિસ્ટ્રેશન રપમી મે, ૧૯૮૦ થી થયેલ છે અને તેનો રજિસ્ટ્રેશન નં. 530319 છે:



અને તેઓ કેમિકલ ફર્ટિલાઈઝર નાં સંદર્ભે પમી જૂન, ૧૯૬૭ થી તેના વપરાશકર્તા છે. અમારા ક્લાયંટ ઉપરોક્ત ટ્રેડ માર્ક અંતર્ગત અન્ય પ્રકારના કેટલાક રજિસ્ટ્રેશન્સ જેવા કે ફર્ટિલાઈઝર્સ ઉદ્યોગો માં વાપરતાં કેમિકલ ઉત્પાદનો, વિજ્ઞાન, ખેતી, બાગાયત, વન, ખાતરો, સોઈલ કંડિશનિંગ અને રિજનેરેટિંગ પેદાશો, રોપા વિકાસ-વૃદ્ધિ કરનાર પદાર્થો અને સજીવો અને સૂક્ષ્મ પોષક દ્રવ્યો બાબત વિવિધ રજિસ્ટ્રેશન્સ ધરાવે છે. આ બધાજ રજિસ્ટ્રેશન્સ આજની તારીખે ચાલુ અને માન્ય છે.

અમારા ક્લાયંટ વૈવિધ્યસભર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા વિશાળ શ્રેણીના ખાતરો અને રાસાયણિક ઉત્પાદનોના ઉત્પાદન અને માર્કેટિંગમાં સામેલ એક પ્રખ્યાત એન્ટિટી છે. ઉપરોક્ત ટ્રેડમાર્ક અને તેના પ્રકારોના નોંધાયેલા માલિક હોવા ને નાતે ફક્ત અમારા ક્લાયંટ સદર ટ્રેડમાર્ક અને તેના પ્રકારોનો ઉપરોક્ત વસ્તુઓના સંબંધમાં ઉપયોગ કરવાનો તથા તેના ઉલ્લંઘન ના સંદર્ભે ટ્રેડમાર્ક એક્ટ, ૧૯૮૮ ની સંબંધિત કલમો હેઠળ રાહત મેળવવાના સર્વ સામાન્ય કાયદાના અધિકારો તથા કાનૂની અધિકારો ધરાવે છે.

વેપારીઓ, જાહેર સભ્યો અને વ્યક્તિઓ ને આથી કોઈપણ અનૈતિક ઉત્પાદકો કે વ્યાપારીઓ કે જેઓ સાથે અમારા ક્લાયંટનું કોઈ લેવાદેવા અથવા જોડાણ નથી અને જેઓ તેમના ઉત્પાદનો કે માલ ને ઉપરોક્ત ટ્રેડમાર્ક અને તેના પ્રકારો અથવા તેને સામ્ય બીજા કોઈ બ્રામક માર્ક હેઠળ ખોટી રીતે રજૂ કરી રહ્યા હોય અથવા પસાર કરી રહ્યા હોય, તેઓથી ચેતવવામાં તથા સૂચિત કરવા માં આવે છે. તેથી, જાહેર જનતા ને આવી કોઈપણ વ્યક્તિઓ કે કંપનીઓ પાસેથી માલ ખરીદવા સામે ચેતવણી આપવામાં આવે છે.

માત્ર અમારા ક્લાયંટ જ ઉપરોક્ત ટ્રેડમાર્ક અને તેના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરવા અથવા અન્યને આવા પ્રકારના પરવાના કરારના આધારે તેનો ઉપયોગ કે અધિકૃત કરવા દેવા માટે હકદાર છે . નોટિસ દ્વારા લાગતાવળગતાઓને સૂચના આપવામાં આવે છે કે અમારા ક્લાયંટના ઉપરોક્ત ટ્રેડમાર્ક અને તેના પ્રકારો અથવા તેના જેવા ટ્રેડમાર્ક(સ) નો બ્રામક ઉપયોગ કોઈપણ અનાધિકૃત વ્યક્તિ(ઓ) દ્વારા કરવામાં આવશે તો તે અમારા ક્લાયંટના કાનૂની તેમજ સામાન્ય કાયદાના અધિકારોનું કાયદાકીય ઉલ્લંઘન સમાન છે. ઉપરોક્ત ટ્રેડમાર્ક પર અમારા ક્લાયંટના વિશિષ્ટ અધિકારોના ઉલ્લંઘનની સ્થિતિમાં, અમારા ક્લાયંટને યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડશે.

વેપારી સભ્યો અને સામાન્ય જનતા ખાસ કરીને ખેડૂતોને પણ સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ અનધિકૃત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ કોઈપણ ઈમેઈલ સંદેશાવ્યવહાર, જાહેરાતો અથવા વિનંતી દ્વારા આકર્ષિત ન થવું અથવા લલચાવું નહીં. અમારા ક્લાયંટ આવી સંસ્થાઓ વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેશે તથા લોકોને મોટાપાયે ગેરમાર્ગે દોરવાના તેમના પ્રયત્નો ને નિષ્ફળ કરશે.

તારીખ : _____ મે, ૨૦૨૦

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ વતી :

આર.કે. ઢીવાન ઁન્ડ કું
ટ્રેડ માર્કસ ઁન્ડ પેટન્ટ ઁટર્ની
પાંચમો માળ, પોટર ચેમ્બર્સ,
ઁસ.ઁ. બ્રેલ્વી રોડ, ફોર્ટ,
મુંબઈ - ૪૦૦૦૦૧.